


# SHASHIJIT INFRAPROJECTS LIMITED

Construction Engineers  
ISO 9001:2015 Certified



9<sup>th</sup> September, 2023

To,  
The Department of Corporate Services,  
BSE Limited,  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street,  
Mumbai-400001

Scrip Code : 540147  
Security ID : SHASHIJIT

Subject : Newspapers clippings – Notice of 16<sup>th</sup> Annual General Meeting and instructions for E-voting and other related information.

Dear Sir/Madam,

Pursuant to Regulation 47 of SEBI (LODR) Regulations, 2015, please find attached herewith copy of Newspaper Advertisement confirming dispatch of Notice of 16<sup>th</sup> Annual General Meeting and instructions for E-voting and other related information.

The Advertisement published in “FINANCIAL EXPRESS” (Gujarati Newspaper) and in “INDIAN EXPRESS” (English Newspaper) dated 9<sup>th</sup> September, 2023.

Kindly take the same in your record.

Thanking you.

Yours Faithfully,

For SHASHIJIT INFRAPROJECTS LIMITED

MANTHAN  
DINESHKUMAR SHAH

Digitally signed by MANTHAN  
DINESHKUMAR SHAH  
Date: 2023.09.09 16:54:14 +05'30'

(MANTHAN D. SHAH)

Company Secretary and Compliance Officer

ACS A42509

Encl. As above

**Registered & Corporate Office:**  
Plot No. 209, Shop No. 23, 2<sup>nd</sup> Floor,  
Girnar Khushboo Plaza, GIDC,  
Vapi-396195, Gujarat, India.

T : +912602432963, 7878660609  
E : info@shashijitinfraprojects.com  
W : www.shashijitinfraprojects.com  
CIN: L45201GJ2007PLC052114

Market	Segment	Minimum		Maximum		Average		Total Mus
		Price (₹/KW/h)	Volume (Mus)	Price (₹/KW/h)	Volume (Mus)	Price (₹/KW/h)	Volume (Mus)	
IDAS	Conventional	5.00	0.04	10.00	3.39	9.31	0.63	16.34
TAM	DAC	2.24	8.23	10.00	47.76	7.03	26.01	806.31
TAM	INTRADAY	6.47	0.22	10.00	1.98	9.91	0.73	9.52
GTAM	NONSOLAR	2.95	0.06	10.00	2.52	8.14	0.80	21.33
GTAMSOLAR	DAC	2.18	0.18	8.20	0.67	6.67	0.41	5.27
GTAMHydro	DAC	6.55	1.66	9.28	1.19	8.19	1.42	2.85
ReverseAuction	ANYDAY	5.04	3.36	9.90	10.11	6.97	5.84	180.93
	DAILY	10.00	0.08	10.00	0.08	10.00	0.08	0.56
UPC	WEEKLY	6.28	5.18	6.53	9.60	6.44	7.56	105.87

**SHASHIJIT INFRAPROJECTS LIMITED**  
 CIN: L45201GJ2007PLC052114  
 Regd. Office: Plot No. 209, Shop No. 23, 2nd Floor, Ginnar Khushboo Plaza, GIDC, Vapi-396195, Gujarat, India. | Mo. +91-7878660609  
 E: investors@shashijitinfraprojects.com | W: www.shashijitinfraprojects.com

**૧૬મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ અને ઈ-વોટિંગની માહિતી**  
 આથી સૂચના આપવામાં આવે છે કે, કંપનીના સભ્યોની ૧૬મી વાર્ષિક સામાન્ય સભા ("એજુએમ") તારીખ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ શનિવારના રોજ ભારતીય સમય બપોરે ૦૨.૦૦ વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ ("વીડી") / અથવા ઓફિસો ઓનલાઇન મીડિયમ (ઓએવીએમ) દ્વારા કંપની અધિનિયમ ૨૦૧૩ની તમામ લાગુ જોગવાઈઓ અને તે હેઠળના નિયમો અને સેબી (લીસ્ટિંગ ઓવરલોગેન્સ એન્ડ ડિસ્ક્લોઝર ની જરૂરિયાતો) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ અને સાથે કોપાઈટ બાબતોના મંત્રાલય ("એમસીએ") દ્વારા જારી કરાયેલ રૂઠ્ઠા ડિસ્પોઝિટ, ૨૦૨૩ના સામાન્ય પરિપત્ર નંબર ૧૦/૨૦૨૨, અને ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ ("સેબી") દ્વારા જારી કરાયેલ પત્રો જાન્યુઆરી, ૨૦૨૩ના સુધી નં. સેબી/એચઓ/સીઓ-૨/વીઓ-૨/વીઓ-૨/૨૦૨૩/૪ અને એમસીએ અને સેબી દ્વારા સમયાંતરે જારી કરાયેલ અન્ય પરિપત્રો મુજબ કંપનીની ૧૬મી વાર્ષિક સામાન્ય સભાની સુચનામાં નિર્ધારિત વ્યવસ્થાઓ વ્યાજબી રીતે માટે સામાન્ય રીતે સભ્યોની ભૌતિક હાજરી વિના ચોખ્ખો. વીસી/ઓએવીએમ સુવિધા દ્વારા ભાગ લેનારા સભ્યોની ગણતરી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૩ અંતર્ગત કોરપોર્નેટ ગણતરીના હેતુ માટે કરવામાં આવશે. વાર્ષિક સામાન્ય સભા માટેનું સ્થળ કંપનીની નોંધણી કરેલી પ્લોટ નંબર ૨૦૯, ડુકાન નંબર ૨૩, વીજ નગર, ગિરનાર ખુરુનું પ્લાટ, જુહાપુરાઈસી, વાપી - ૩૬૬૧૧૫, ગુજરાત રાજ્યના માનવામાં આવશે.

**એજુએમ ઇ-વોટિંગ રીમોટ ઈ-વોટિંગ અને ઈ-મતદાન માટેની સૂચના:**  
 કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૦૮ ની શરતોમાં, કંપનીઓ (નેશનલ એન્ડ એક્સિટરિયર) નિયમો, ૨૦૧૩ના જે સમય-સમય પર સુધારેલા નિયમ ૨૦ અને સેબી ના નિયમ ૪૪ (લિસ્ટિંગ ઓવરલોગેન્સ એન્ડ ડિસ્ક્લોઝર ઓફ સ્પેક્ટ્રાલ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ સાથે વાજી, કંપની તેના સભ્યોને એજુએમ પર પસાર થવાના સૂચિત તમામ ઠરાવો પર ઈલેક્ટ્રોનિક માધ્યમ (ઈ-મતદાન) દ્વારા તેમના મત આપવાના અધિકારનો ઉપયોગ કરવાની સુવિધા પુરી પાડે છે. સભ્યો અહીં જણાવેલ તારીખો પર સીડીએસએલ દ્વારા પ્રદાન થયેલ ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી (રિમોટ ઈ-મતદાન) નો ઉપયોગ કરીને મત આપી શકે છે.

ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી દ્વારા મતદાન કરવાની સુવિધા એજુએમ (ઈ-મતદાન) પર પછા ઉપલબ્ધ કરવામાં આવશે અને રિમોટ ઈ-મતદાન દ્વારા પોતાનો મત (ઓ) ન આપનારા એજુએમમાં હાજર રહેલા સભ્યો એજુએમમાં ઈ-મતદાન કરી શકશે. ઈ-મતદાન સંબંધિત ચુસ્ત આઈડી અને પાસવર્ડ સહિતની લોગીન વિગતો અને સુચનાઓ ઈ-મેઈલ દ્વારા સભ્યોને મોકલવામાં આવી છે. વીસી/ઓએવીએમ દ્વારા એજુએમમાં ભાગ લેવા માટે સમાન લોગીન વિગતોનો ઉપયોગ કરવાનો રહેશે. રિમોટ ઈ-મતદાન અને ઈ-મતદાનની રીત, શેર ધરાવતા જે સભ્યોએ પોતાનું ઈ-મેઈલ સંબંધિત નોંધણી કરી, તેમને એજુએમની સુચનામાં પ્રદાન કરવામાં આવ્યું છે અને ડીપોઝિટરી સહભાગીઓ કે જેમની સાથે તેઓ તેમના ડીમેટ ખાતા જાળવે છે તેમના ઈ-મેઈલ સંબંધિત નોંધણી/અપડેટ કરવા વિનંતી. રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો બુધવાર, ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે શરૂ થાય છે અને શુક્રવાર, ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે સમાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન, સભ્યો ઈલેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શકે છે. ઈ-મતદાન નોંધણી ત્યારબાદ સીડીએસએલ દ્વારા અક્ષમ કરવામાં આવશે. જે વ્યક્તીનું નામ સભ્યોના રજીસ્ટરમાં અથવા લાભકારક માલિકોના રજીસ્ટરમાં છેલ્લી તારીખ પ્રમાણે એન્ટ્રી કે શનિવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ડીપોઝિટરી દ્વારા જાળવવામાં આવતા નોંધાયેલ છે, તે જ રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગની સુવિધા મેળવવાનો અને સમાન્ય સમાન મતદાન કરવાનો હકદાર રહેશે. એજુએમની નોટિસ મોકલ્યા પછી જે સભ્યોએ શેરો સંપાદિત કરી લીધા છે અને છેલ્લી તારીખ એન્ટ્રી કે શનિવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ કંપનીના સભ્ય બન્યા છે એવો એજુએમની સુચનામાં આપેલી રીતે કે કંપનીની વેબસાઈટ અને સીડીએસએલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે તે મુજબ ચુસ્ત આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. આવા સભ્યો એજુએમની સુચનામાં આપેલી ઈ-મતદાન સુચનાનો ઉપયોગ કરીને તેમના મત આપી શકે છે. રિમોટ ઈ-વોટિંગ દ્વારા પોતાનો મત આપનારા સભ્યો એજુએમમાં હાજરી આપી શકે છે પરંતુ તેઓ ફરીથી મતદાન કરવાનો હકદાર રહેશે નહીં. એક્સચેન્જ સભ્ય દ્વારા ઠરાવ પર મત આપ્યા પછી, તે/તેણીને તે પછીથી મત બદલવાની અથવા ફરીથી મત આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ઈ-વોટિંગ સંબંધિત વિગતો માટે, કૃપા કરીને એજુએમની સુચનાનો સંદર્ભ લો. ઈ-વોટિંગ સિસ્ટમમાંથી એજુએમ અને ઈ-વોટિંગમાં હાજરી આપવા સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા સમસ્યાઓના કિસ્સામાં, તમે www.evotingindia.com પર ઉપલબ્ધ વાસ્તવ પુષ્ટતા પ્રશ્નો ("FAQs") અને ઈ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો અથવા helpdesk.evoting@cdsindia.com પર ઈ-મેઈલ લખી અથવા વીડિયો કોન્ફરન્સિંગ, સિનિયર મેનેજર, (સીડીએસએલ) એન્ડ ડિપોઝિટરી સર્વિસીસ (ઈલિટી) લિમિટેડ, એવિંગ, સર્વો માળ, મહેસાણા જ્યુરોરેસ, મહત્વાન લાલ કંપાઉન્ડિંગ, એન એમ જોશી માર્ગ, લોન્કર પેરેલ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૧૩ નો સંપર્ક કરી શકે છે અથવા helpdesk.evoting@cdsindia.com પર ઈ-મેઈલ મોકલી શકે છે અથવા ટેલ ફોન નંબર ૧૮૦૨૨૨૫૩૩ પર કોલ કરો.

**નોર્ડના આદેશથી**  
**શશિજીટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ**  
 સહી/-  
**મંથન ડી. શાહ**  
 તારીખ : ૯ મી સપ્ટેમ્બર, ૨૦૨૩  
 સ્થળ : વાપી  
 કંપની સચિવ અને અનુપાલન અધિકારી

**PUBLIC NOTICE**  
 Notice regarding Loss of Share Certificates of ABB INDIA LTD., Regd. Office : Disha, Corporate office, 3<sup>rd</sup> Floor, Plot No.5 & 6, 2<sup>nd</sup> stage, Peenya Industrial Area IV, Peenya, Bengaluru-560058, Karnataka. We (1) Urmila Natverlal Bastawala (Deceased) (2) Sunil Natverlal Bastawala (3) Madhuri Sunil Bastawala (Registered share holders of the under mentioned shares jointly held in the above said company, hereby give notice that the share certificates in respect of the said shares have been lost/impounded and we have applied to the company for issue of Duplicate share certificate. Any person having claim in respect of the said shares should lodge such claims with the company at its above referred address within 21 days from this date, else the company will proceed to issue duplicate share certificate and no further claim will be entertained by the company thereafter.

SHARES CERT NO.	FROM	TO	NO. OF SHARES
3567	2146181	2146210	30
21922	7530485	7530534	50
23604	12605441	12605450	10
42001	24640863	24640872	10
54339	24788047	24788056	10
70150	9697063	9697112	50
70151	9697113	9697130	18
70152	9697131	9697180	50
70153	9697181	9697187	7
74503	15428848	15428897	50
74504	15428898	15428907	10
74505	15428908	15428917	10
74506	15428918	15428927	50
131526	27269415	27269464	50
131527	27269465	27269474	10
131528	27269475	27269479	5
131529	27269480	27269480	10
278618	37646547	37646556	10
278619	37646557	37646566	10
280674	37667278	37667287	10
280676	37667289	37667307	10
392714	41154424	41154473	50
392715	41154474	41154483	10
392716	41154484	41154493	10
392717	41154494	41154503	10
392718	41154504	41154508	5
392719	41154509	41154509	1
392720	41154510	41154510	1
392721	41154511	41154511	1
<b>TOTAL</b>			<b>504</b>
Face Value Rs 10/- each			

Date : 08/09/2023 1: Sunil Natverlal Bastawala  
 2: Madhuri Sunil Bastawala

**TEERTHANKER MAHAVEER UNIVERSITY**  
 Accredited with NAAC A Grade  
 12-B Status from UGC  
 www.tmu.ac.in

**LAST OPPORTUNITY FOR MBBS/BDS ADMISSION THROUGH MOP-UP ROUND**  
**ONLINE COUNSELING OF UP NEET UG - 2023**  
**08 સપ્ટેમ્બર 2023 સે 11 સપ્ટેમ્બર 2023 તક**

**TEERTHANKER MAHAVEER MEDICAL COLLEGE**  
 (Recognized by Govt. of India)

**TEERTHANKER MAHAVEER DENTAL COLLEGE**

**MBBS 16<sup>th</sup> Batch**      **BDS 19<sup>th</sup> Batch**

**ADMISSIONS STRICTLY THROUGH UP NEET UG COUNSELING**  
**NEET QUALIFIED CANDIDATES ARE ADVISED TO REGISTER THEMSELVES ON GOVT. OF U.P. WEBSITE https://upneet.gov.in**  
**& FOR MORE INFORMATION VISIT www.dgme.up.gov.in**

**Special Scholarship to Jain Candidates in Tuition Fees (Entire Program)**  
 Preference will be given to Jain aspirants

**U.P. DOMICILE NOT REQUIRED (OPEN FOR ALL INDIA NEET QUALIFIED CANDIDATES)**

**MBBS**      **BDS**  
 9568518000, 9568519000      9410095005, 9808723156  
 director.admin@tmu.ac.in      drankita.dental@tmu.ac.in

**Contact For Admissions**

**pnb cards & services limited**  
 (a wholly owned subsidiary of PNB)  
 Regd Off: PNB Head Office, Plot No.4, Sector 10, Dwarka.  
 Corp. Off: 6th Floor, 7, Bhikaji Cama Place, New Delhi-110067, Email: hr@pnbcsl.co.in

**INVITATION FOR REQUEST FOR EMPANELMENT (RFE)**  
 PNB Cards & Services Limited (PNBCSL) is a wholly owned subsidiary of Punjab National Bank inviting sealed RFP for Empanelment of Agencies for Supply of Off Roll Staff on Contractual Basis at various locations across India. The details of empanelment can be downloaded from the website <https://pnbcsl.in>  
 Last date for submission of application is 25.09.2023  
 Addendum/Modification, if any shall be notified only on the Company's website.  
 Authorised Signatory

**NATIONAL FERTILIZERS LIMITED**  
 (A Govt. of India Undertaking)  
 Phone - 0120 2412294, 2412445, Fax: 0120 2412218

Ref No : NFL/FPS/SWG/2023-24/01      Date: 08.09.2023

**e-Application**

Applications are invited from the prospective bidders for Empanelment of Seaweed Granules (SWG) units for supply and further Marketing in different States. For details visit website: <https://tenders.gov.in/procure/app> (e-tendering) & [www.nationalfertilizers.com](http://www.nationalfertilizers.com) (Homepage). E-Tender No.2023\_NFL\_166717\_1. Last date of bid submission / Opening of Technical Bid document is - 15.30 Hrs on 27.09.2023 / 15.30 Hrs on 28.09.2023. Any Corrigendum (s) to this tender shall be published only on our websites.  
 Dy General Manager (I/c), FPS (I&D)  
 @NFL\_Kisan @nationalfertilizers National Fertilizer Limited

Government of India  
 Public Enterprises Selection Board  
 invites applications for the post of  
**Chairman & Managing Director**  
 in  
**Balmer Lawrie & Co. Ltd.**  
 Last date of submission of application by the applicant is  
**03rd October, 2023**  
 Last date of forwarding of applications by the Nodal officers to PESB is  
**12th October, 2023**  
 For details login to website  
<http://www.pesb.gov.in>

**સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા**  
**CENTRAL BANK OF INDIA**

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, વાલ દરવાજા, અમદાવાદ - ૩૮૦ ૦૦૧.

**પરિશિષ્ટ-૪ (નિયમ ૮(૧))**  
**કંપની નોટીસ (સ્થાવર મિલકત માટે)**

આથી, નીચે સહી કરનારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, આઈ.સી.સી. યુ. આઈ.સી. (ગુજરાત) ના અધિકૃત અધિકારી તરીકે સિક્યોરીટીઝરોગેશન એન્ડ ડિસ્કોન્ટ્રોલ ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો રૂબે ૦૩/૦૩/૨૦૨૩ ની તારીખની ડિમાન્ડ નોટીસ જારી કરીને દેવાદાર શ્રી સંદીપભાઈ શમીકર્માઈ મહેતા, શ્રી શમીકર્માઈ મહેતા અને શ્રીમતી નયના શ્રી સંદીપભાઈ શમીકર્માઈ મહેતા નો નોટીસમાં જણાવેલ રૂ. ૨૬,૬૩,૨૮૮.૦૦/- (રૂપિયા: અગણતરીસ લાખ ત્રેસઠ હજાર બસો નવેસાતી પુરા) (જે ૦૨/૦૩/૨૦૨૩ ના રોજની મૂળ રકમ વાત વ્યાજનો આલેખ છે) ની બાકી રકમ વાત નોટીસમાં જણાવેલ મુજબની તારીખ ૦૩/૦૩/૨૦૨૩ થી વ્યાજ, કથિત નોટીસ મળ્યાની તારીખથી દુગ દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું. દેવાદાર રકમ પરત ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, દેવાદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યોરીટી ઈન્વેસ્ટમેન્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો રૂબે અહીં નીચે વર્ણવેલી મિલકતનો સંકલિત કરખો નં. ૦૬.૦૯.૨૦૨૩ ના રોજ વર્ણવેલો છે. દેવાદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઈપણ વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બાકી રૂ. ૨૬,૬૩,૨૮૮.૦૦/- (રૂપિયા: અગણતરીસ લાખ ત્રેસઠ હજાર બસો નવેસાતી પુરા) (જે ૦૨/૦૩/૨૦૨૩ ના રોજની મૂળ રકમ વાત તારીખ ૦૩/૦૩/૨૦૨૩ થી વ્યાજ તથા સર્ચાર્જ ચાર્જિસના ચાર્જને આલેખ રહેશે. સુરક્ષિત મિલકતો છોડાવા માટે ઉપલબ્ધ સમય અને એક્સપીરેન્સી કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ પ્રત્યે દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે.

**સ્થાવર મિલકતનું વર્ણન**

૧. શ્રી સંદીપભાઈ શમીકર્માઈ મહેતા ના નામે ગિરવ મુકેલી મિલકત જેનો રેવન્યુ સર્વે નં. ૫૨૦, ૫૨૧, ૫૨૨, ટી.પી. સ્કેમ નં. ૬૧ એફ.પી. નં. ૧૨, કુલ જમીનનો વિસ્તાર ૧૪૮૨૨ સ્કે મીટર વ્લોક એચ પેકી ૩૧૦ માળ, ફ્લેટ નં. ૩૦૩, ભ્રમજી અરોયા ૧૬૬૨.૨૨ સ્કે મીટર સુબ ગિલ્ટ ઝા અને અન્ય કોમન વિસ્ટા-૬૪ સ્કે મીટર, સતવા ઓપ્ટીમીઝ, મોજે ગોશી, જુલો વડોદરા, ૩૮૦૦૨૨ ની ચલુ-સીમા: પૂર્વ: એફ પી. નં. ૧૮૨, પશ્ચિમ: ફ્લેટ નં. એચ-૩૦૨, ઉત્તર: ફ્લેટ નં. એચ-૩૦૨, દક્ષિણ: ટાવર્ડ

સહિકૃત અધિકારી  
 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ  
 તારીખ : ૦૬.૦૯.૨૦૨૩

**PUBLIC NOTICE**  
 TO WHOMSOEVER IT MAY CONCERN  
 This is to inform the General Public that the following Share Certificates of Colgate-Palmolive (India) Limited having its Registered Office at Colgate Research Centre, Main Street, Hiranandani Gardens Powai, Mumbai-400076 registered in the name of the following Shareholders have been lost by them.

Sr. No.	Name of Shareholders	Folio No.	Certificate No.	Distinctive Numbers	No. of Shares
1	Naina Narendra Kumar & Narendra Kumar Laxmidass (dec.)	N12962	2061805 2025218	138263463 - 138263658 132782230 - 132782425	196 Shares 196 Shares

The Public are hereby cautioned against purchasing or dealing in any way with the above referred Share Certificate. Any person who has any claim in respect of the said Share Certificate should lodge such claim with the Company or its Registrar & Transfer Agents Link Intime India Pvt. Ltd., 247 Park, C-101, 1st Floor, L.B.S. Marg, Vikhroli (W) Mumbai - 400083, Tel - 022 49186270. Within 15 days of publication of this Notice after which no claim will be entertained and the Company shall proceed to issue Duplicate Share Certificate.  
 Kolkata 07/09/2023 Naina Narendra Kumar / Narendra Kumar Laxmidass (dec.)

**સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા**  
**CENTRAL BANK OF INDIA**

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, વાલ દરવાજા, અમદાવાદ - ૩૮૦ ૦૦૧.

**પરિશિષ્ટ-૪ (નિયમ ૮(૧))**  
**કંપની નોટીસ (સ્થાવર મિલકત માટે)**

આથી, નીચે સહી કરનારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, આઈ.સી.સી. યુ. આઈ.સી. (ગુજરાત) ના અધિકૃત અધિકારી તરીકે સિક્યોરીટીઝરોગેશન એન્ડ ડિસ્કોન્ટ્રોલ ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્વેસ્ટમેન્ટ એન્ડ, ૨૦૦૨ હેઠળ અને સિક્યોરીટી ઈન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૨) હેઠળ પ્રાપ્ત સત્તાનો રૂબે ૦૩/૦૩/૨૦૨૩ ની તારીખની ડિમાન્ડ નોટીસ જારી કરીને દેવાદાર શ્રી સંદીપભાઈ શમીકર્માઈ મહેતા, શ્રી શમીકર્માઈ મહેતા અને શ્રીમતી નયના શ્રી સંદીપભાઈ શમીકર્માઈ મહેતા નો નોટીસમાં જણાવેલ રૂ. ૧૧,૨૬,૦૨૮.૦૦/- (રૂપિયા: અગણતરીસ લાખ અગણતરીસ હજાર અઠસવાસી પુરા) (જે ૦૨/૦૩/૨૦૨૩ ના રોજની મૂળ રકમ વાત વ્યાજનો આલેખ છે) ની બાકી રકમ વાત નોટીસમાં જણાવેલ મુજબની તારીખ ૦૩/૦૩/૨૦૨૩ થી વ્યાજ, કથિત નોટીસ મળ્યાની તારીખથી દુગ દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું. દેવાદાર રકમ પરત ચુકવવામાં નિષ્ફળ ગયા હોવાથી, દેવાદાર અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારે સિક્યોરીટી ઈન્વેસ્ટમેન્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ સાથે વંચાતી કલમ ૧૩ ની પેટા કલમ (૪) હેઠળ તેમને પ્રાપ્ત સત્તાનો રૂબે અહીં નીચે વર્ણવેલી મિલકતનો સંકલિત કરખો નં. ૦૬.૦૯.૨૦૨૩ ના રોજ વર્ણવેલો છે. દેવાદાર અને જાહેર જનતાને મિલકત સાથે કોઈપણ વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બાકી રૂ. ૧૧,૨૬,૦૨૮.૦૦/- (રૂપિયા: અગણતરીસ લાખ અગણતરીસ હજાર અઠસવાસી પુરા) (જે ૦૨/૦૩/૨૦૨૩ ના રોજની મૂળ રકમ વાત વ્યાજ તથા સર્ચાર્જ ચાર્જિસના ચાર્જને આલેખ રહેશે. સુરક્ષિત મિલકતો છોડાવા માટે ઉપલબ્ધ સમય અને એક્સપીરેન્સી કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ પ્રત્યે દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે.

**સ્થાવર મિલકતનું વર્ણન**

૧. શ્રી સંદીપભાઈ શમીકર્માઈ મહેતા ના નામે ગિરવ મુકેલી મિલકત જેનો રેવન્યુ સર્વે નં. ૫૨૦, ૫૨૧, ૫૨૨, ટી.પી. સ્કેમ નં. ૬૧ એફ.પી. નં. ૧૨, કુલ જમીનનો વિસ્તાર ૧૪૮૨૨ સ્કે મીટર વ્લોક એચ પેકી ૩૧૦ માળ, ફ્લેટ નં. ૩૦૩, ભ્રમજી અરોયા ૧૬૬૨.૨૨ સ્કે મીટર સુબ ગિલ્ટ ઝા અને અન્ય કોમન વિસ્ટા-૬૪ સ્કે મીટર, સતવા ઓપ્ટીમીઝ, મોજે ગોશી, જુલો વડોદરા, ૩૮૦૦૨૨ ની ચલુ-સીમા: પૂર્વ: એફ પી. નં. ૧૮૨, પશ્ચિમ: ફ્લેટ નં. એચ-૩૦૨, ઉત્તર: ફ્લેટ નં. એચ-૩૦૨, દક્ષિણ: ટાવર્ડ

સહિકૃત અધિકારી  
 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ  
 તારીખ : ૦૬.૦૯.૨૦૨૩

**ixigo**

**LE TRAVENUES TECHNOLOGY LIMITED**  
 Regd. Office: Second Floor, Veritas Building, Sector-53, Golf Course Road, Gurugram-122 002, Haryana, India. CIN: U63000HR2006PLC07154

**INDIAN INSTITUTE OF SCIENCE EDUCATION AND RESEARCH PUNE**  
(An Autonomous Institution of Ministry of Education, Govt. of India)  
Dr. Homi Bhabha Road, Pune-411008. Website: www.iiserpune.ac.in

**RECRUITMENT: NON-TEACHING POSITION**

Institute invites online applications from Indian nationals having excellent academic record for the position of "Office Superintendent" (Level-6, Unreserved).

For detailed advertisement and filling online application, please visit [www.iiserpune.ac.in](http://www.iiserpune.ac.in) and click on the link "Opportunities- Non-teaching/Project". The last date for submission of online applications is **September 27, 2023**.

**Advt. No.: 51/2023 dated 07.09.2023 REGISTRAR**

**GUJARAT POLLUTION CONTROL BOARD**  
Paryavaran Bhavan, Sector 10 A, Gandhinagar 382 010  
Tel 079-2323152 Fax 079-23222784 www.gpcb.gujarat.gov.in

**PUBLIC NOTICE**

It is hereby to inform that as per Ministry of Environment, Forest & Climate Change, Government of India, New Delhi vide its Notification no. S.O. 1533 (E) dated September 14, 2006, Public Hearing has been fixed for **M/s Selan Exploration Technology Limited, for Proposed Expansion of Onshore Oil and Gas Development and Production project in Karjisan Oil & Gas Field in the Cambay Basin, at Village: Karjisan, Ta. Kadi, Dist. Mehsana**, covered under project category "A" as mentioned in their request application.

All local affected persons of the project are requested to remain present in the public hearing or send their response in writing to Member Secretary, Gujarat Pollution Control Board before the hearing date.

Other concerned persons having a plausible stake in environment aspects of the project or activity can submit their responses to Member Secretary, Gujarat Pollution Control Board in writing before the hearing date.

It may be noted that draft Environmental Impact Assessment Report and Executive Summary of the Environment Impact Assessment Report of the project has been sent to the following authorities or offices to make it available for inspection to the public during normal office hours, till the Public Hearing is over.

- District Collector Office, Mehsana.
- District Development Office, Mehsana.
- District Industry Centre, Mehsana.
- Taluka Development Office, Ta. Kadi, Dist. Mehsana.
- Regional Office, Integrated Grid Agency, Ministry of Environment, Forests and Climate Change, Room No. 407, Aranya Bhawan, Near CH-3 Circle, Sector - 10A, Gandhinagar, Gujarat - 382010.
- Regional Office, Gujarat Pollution Control Board, Mehsana.

H/3, A-Phase I, GIDC Estate, Near GIDC Office, Modhera Road, Mehsana -384 002.

The District Magistrate /District Collector / Deputy Commissioner or his/her representative not below the rank of an Additional District Magistrate or any other District Level Officer authorized by him/her in this behalf shall supervise and preside over the entire public hearing process.

(Note:- If a project or activity is confined to the territorial jurisdiction of one sub-division, the District Magistrate/District Collector/Deputy Commissioner may alternatively authorize any officer not below the rank of Sub-Divisional Magistrate to supervise and preside over the entire public hearing process).

The Public Hearing is scheduled to be held on **13/10/2023 at 11:00 Hrs. Venue: Shri Swaminarayan Siddhant Sajeewan Mandal, Shri Mukti Jivan Swami Bapa Wadi, Village: Karjisan, Ta. Kadi, Dist. Mehsana.**

Considering the present situation of pandemic of Covid-19 all concerned are hereby informed to follow Government guidelines regarding Covid-19 pandemic.

**Place: Gandhinagar D. M. Thaker**  
**Date: 05/09/2023 Member Secretary**

**SHASHIJIT INFRAPROJECTS LIMITED**  
CIN: L45201GJ2007PLC052114

Regi. Office: Plot No. 209, Shop No. 23, 2nd Floor, Girnar Khushboo Plaza, GIDC, Vapi-396195, Gujarat. India. | Mo. +91-7878660609  
E: investors@shashijitinfra.com | W: www.shashijitinfra.com

**NOTICE OF 16th ANNUAL GENERAL MEETING AND INFORMATION OF E-VOTING**

NOTICE is hereby given that the 16th Annual General Meeting (AGM) of the Company, scheduled to be held on Saturday, 30th September, 2023 at 02:00 P.M. through Video Conferencing (VC)/Other Audio Visual Means (OAVM) in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circular No. 10/2022 dated 28th December, 2022 issued by Ministry of Corporate Affairs ("MCA"), Circular No. SEBI/HO/CFD/PoD-2/PICIR/2023/4 dated 5th January, 2023 Issued by Securities and Exchange Board of India ("SEBI") and other Circulars Issued by MCA and SEBI, to transact the Business, as set out in the Notice of AGM. Members participating through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. The venue of the meeting shall be deemed to be the Registered Office of the Company at Plot No. 209, Shop No. 23, 2nd Floor, Girnar Khushboo Plaza, GIDC, Vapi-396195, Gujarat.

In compliance with the above circulars, the Notice of the AGM and Annual Report for the FY 2022 - 23 have been sent electronically to all the Members whose E-Mail IDs are registered with the Company/Depository Participant(s) and physically to those shareholders whose E-mail IDs are not available on 7th September, 2023. The aforesaid documents are also available on the website of the Company at [www.shashijitinfra.com](http://www.shashijitinfra.com) and at BSE's website [www.bseindia.com](http://www.bseindia.com) and also at CDSL's website [www.evotingindia.com](http://www.evotingindia.com).

Instruction for Remote E-Voting and E-Voting during AGM:  
In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, members are provided with the facility to exercise their right to cast their votes on all resolutions proposed to be passed at AGM by electronic means (E-Voting). Members may cast their votes remotely, using the electronic voting system (Remote E-Voting) provided by CDSL on the dates mentioned herein. The facility to voting through electronic voting system will also be made available at the AGM (E-Voting) and Members attending AGM who have not cast their vote(s) by Remote E-Voting will be able to vote at the AGM through E-Voting. Information and instructions including details of Login ID and Password relating to E-Voting have been sent to the members through E-Mail. The same login credentials should be used for attending the AGM through VC/OAVM. The manner of Remote E-Voting and E-Voting by members holding shares and for members who have not registered their E-Mail address is provided in the notice of the AGM and requested to register/update their email addresses with the Depository Participants with whom they maintain their demat accounts.

Remote E-Voting period commences on Wednesday, 27th September, 2023 at 09:00 AM and ends on Friday, 29th September, 2023 at 05:00 PM. During this period, members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. A person, whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by depositories as on the cut-off date i.e. Saturday, 23rd September, 2023 only shall be entitled to avail the facility of Remote E-Voting or for participation at the AGM and voting through E-Voting. Any person who become a member of the Company after sending the notice of AGM and holds shares as on the cut-off i.e. Saturday, 23rd September, 2023 can obtain/generate Login ID and Password in the manner as provided in the Notice of the AGM, which is available on Company's website and CDSL website. Such members may cast their votes using the E-Voting instructions, in the manner specified by the Company in the notice of AGM. The members who have cast their vote by remote e-voting may attend the AGM but shall not be entitled to cast their vote again. Once the vote on a resolution is cast by the member, he/she shall not be allowed to change it subsequently or cast vote again.

For details relating e-voting, please refer to the Notice of the AGM. In case of any queries or issues regarding attending AGM & E-Voting from the E-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at [www.evotingindia.com](http://www.evotingindia.com), under help section or contact Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to [helpdesk.evoting@cdsindia.com](mailto:helpdesk.evoting@cdsindia.com) or call toll free no. 1800225533.

**By Order of the Board**  
**For SHASHIJIT INFRAPROJECTS LIMITED**  
Sd/-  
Date : 9th September, 2023 Manthan D. Shah  
Place : Vapi Company Secretary & Compliance Officer

**SRG HOUSING FINANCE LIMITED**  
(CIN: L65922RJ1999PLC015440)  
321, S M Lodha Complex, Near Shastri Circle, Udaipur-313001(Rajasthan), Phone 0294-2561882 E-mail: info@srghousing.com Website: www.srghousing.com

**SYMBOLIC POSSESSION NOTICE RULE 8(i) (For Immovable Property)**

Whereas, the undersigned being the authorized officer of SRG Housing Finance Limited, 321, S M Lodha Complex, Near Shastri Circle, Udaipur - 313001 (Rajasthan), under the Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of power conferred under section 13(1) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002, issued demand notices on the dates mentioned against each account calling upon the respective borrowers/co-borrowers/mortgagors/guarantors, to repay the amount within 60 days from the date of receipt of the said notices. The borrowers/co-borrowers/mortgagors/guarantors having failed to repay the amount, notice is hereby issued to the borrowers/co-borrowers/mortgagors/guarantors and the public in general, that the undersigned has taken symbolic possession of the properties described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act, read with rule 9 of the said rules, on the dates mentioned against each account. The borrowers/co-borrowers/mortgagors/guarantors in particular and public in general are hereby cautioned Not to deal with the properties and any dealing with the properties will be subject to the charge of SRG Housing Finance Limited, 321, S M Lodha Complex, Near Shastri Circle, Udaipur - 313001 (Rajasthan), for the amounts mentioned below plus future interest and cost/charges thereon until the realization. The Borrowers/Co-borrowers/Mortgagors/Guarantors attention are invited to the provisions of sub-section (8) of section 13 of the said Act, in respect of time available to redeem the available secured assets.

S. No.	Loan Account Number (Lan)/ NO. Borrowers/Co-Borrowers/Guarantors	1) Date Of Demand Notice 2) Date Of Symbolic Possession 3) Claim Amount As Per Demand Notice	Description Of Immovable Property (Together With Buildings And Structures Constructed, To Be Constructed Thereon Along With Fixtures And Fittings Attached To The Earth And Anything Attached To The Earth.)
1.	HLR000000008808 Mr. Dinubhai Bharwad S/o Mr. Bhimabhai Bharwad (Borrower) Mrs. Kajalben Dinubhai Bharwad W/o Mr. Dinubhai Bharwad (Co-Borrower) Mr. Dineshbhai Parmar S/o Mr. Ghanshyambhai Parmar (Guarantor)	1. Date Of Demand Notice- August 12, 2022 2. Date Of Symbolic Possession- September 04, 2023 3. Claim Amount As Per Demand Notice- ₹ 4,24,990/- Rupees Four Lakh Twenty four Thousand Nine Hundred And Ninety Only As On October 12, 2022 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. October 13, 2022.	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Of Mr. Dinubhai Bharwad S/o Mr. Bhimabhai Bharwad Having Gram Panchayat Property No.- 27/1, Mouje Kanavada, Tehsil-Tarapur, District-Anand (Gujarat) Having Land Area Of 2088.00 Sq.Ft. Surrounded By: East- House Of Bhopalbai Laxmanbhai, West- Public Road, North- House Of Vikrambhai Kashibhai, South-Open Place And Public Road
2.	HLR0000000004617 Mr. Sanjaybhai H. Brahmbhatt S/o Mr. Hasamukhbhai (Borrower) Mrs. Sonalben Brahmbhatt W/o Mr. Sanjaybhai (Co-Borrower) Mr. Makwana Govindbhai S/o Mr. Prabhudas (Guarantor)	1. Date Of Demand Notice- August 11, 2021 2. Date Of Symbolic Possession - September 04, 2023 -- 3. Claim Amount As Per Demand Notice- ₹ 2,99,350/- Rupees Two Lakh Ninety nine Thousand Three Hundred And Fifty Only As On July 26, 2021 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. July 27, 2021.	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Of Mr. Sanjaybhai Hasamukhbhai Brahmbhatt S/o Mr. Hasamukhbhai Having Gram Panchayat Property No.- 457, Moje Pariyaji, Tehsil-Matar, District- Kheda (Gujarat) Having Land Area Of 855.10 Sq. Ft. Surrounded By:- East- Plot Of Mr. Pankajbhai Naharibhai Brahmbhatt, West- House Of Mr. Hiteshbhai Ghanshyambhai Brahmbhatt, North-Plot Of Sanjaybhai Hasamukhbhai Brahmbhatt, South- Common Road

PLACE: Udaipur  
DATE: 09-09-2023

Authorized Officer  
SRG Housing Finance Limited

**MOTILAL OSWAL HOME LOANS**  
CIN Number :- U65923MH2013PLC248741

Corporate Office :- Motilal Oswal Tower, Rahimuliah Sayani Road, Opposite ST Depot, Prabhadevi, Mumbai-400025. Email : hfquery@motilalosal.com.

Branch Office - 2nd Floor, Rockford Business Center, Udhna Darwaja, Surat - 395002, Gujarat Contact No.:- Ankit Barot- 7045155624

Branch Office -Siddhi Vinayak Arcade, 2nd Floor, Shop No.9 (209), Plot No.89, City Survey No.2612, Paikae Village, Morbi - 363641, Gujarat Contact No.:- DATAR SINGH CHOUHAN - 8291180874

Branch Office - Unit No. 1024 to Unit No. 1029, 10th Floor, R. K. Empire, Maveli Bridge, Rajkot - 360005, Gujarat Contact No.:- DATAR SINGH CHOUHAN - 8291180874

**PUBLIC NOTICE FOR E-AUCTION CUM SALE**

E-Auction Sale Notice of 30 days for Sale of Immovable Asset(s) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the **Physical Possession** of which has been taken by the Authorised Officer of **Motilal Oswal Home Finance Limited** (Earlier Known as Aspire Home Finance Corporation limited)/Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on the date and time mentioned herein below, for recovery of the dues mentioned herein below and further interest and other expenses thereon till the date of realization, due to Motilal Oswal Home Finance Limited (Earlier Known as Aspire Home Finance Corporation limited)/Secured Creditor from the Borrowers and Guarantor(s) mentioned herein below. The reserve price, Earnest Money Deposit (EMD) and last date of EMD deposit is also mentioned herein below:

Borrower(s) / Guarantor(s) / Loan Account	Demand Notice Date and Amount	Description of the Immovable property	Reserve Price, EMD & Last Date of Submission of EMD	Date and time of E-Auction
LAN: LXSUR00416-170032640 Branch: SURAT Borrower: MOHAMMADALIM ABDULGAFAR MULLA Co-Borrower: ARIFIYA SALIM MULLA	23-06-2021 for Rs: 1123212/- (Rupees Eleven Lac Twenty Three Thousand Two Hundred Twelve Only)	Flat No - E - 204, 2nd Floor (As Per Plan 1st Floor), Building - E Swapnankunj Apartment, Near Golden Flats, Udhana Main Road, Bhestan, Surat, Gujarat - 394221	Reserve Price: Rs.7,00,000/- (Rupees Seven Lacs Only) EMD: Rs.70,000/- (Rupees Seventy Thousand Only) Last date of EMD Deposit: 16-10-2023	Date: 17/10/2023 Time: 12:00 Pm to 12:30 Pm (with unlimited extensions of 5 minute each)
LAN: LXKANK00217-180051231 Branch: ANKLESHWAR Borrower: RAKESH KUMAR UMAKANT MANDAL Co-Borrower: ANJU DEVI UMAKANT MANDAL	14-09-2021 for Rs: 1043148/- (Rupees Ten Lac Forty Three Thousand One Hundred Forty Eight Only)	Plot - 116, Green Park Village - Jitali, Near Green City Society, Taluka - Ankleshwar, Bharuch, Gujarat - 393010	Reserve Price: Rs.6,20,000/- (Rupees Six Lacs Twenty Thousand Only) EMD: Rs.62,000/- (Rupees Sixty Two Thousand Only) Last date of EMD Deposit: 16-10-2023	Date: 17/10/2023 Time: 12:30 Pm to 01:00 Pm (with unlimited extensions of 5 minute each)
LAN: LXMOR00416-170036897 Branch: MORBI Borrower: ISMAIL MAMADBHAI SIPAI Co-Borrower: SHARIFA ISMAIL SIPAI	19-12-2020 for Rs: 1213125/- (Rupees Twelve Lac Thirteen Thousand One Hundred Twenty Five Only)	Plot No - 43, Survey No. - 145/1, Jalaram Nagar, Near Bhatiyai Society, Jalaram Nagar 3, Behind Jalaram Jin, Neelje - Chandrapur City, Wankar, Morbi, Rajkot, Gujarat - 363621	Reserve Price: Rs.10,50,000/- (Rupees Ten Lacs Fifty Thousand Only) EMD: Rs.10,500/- (Rupees One Lac Five Thousand Only) Last date of EMD Deposit: 16-10-2023	Date: 17/10/2023 Time: 1:00 Pm to 01:30 Pm (with unlimited extensions of 5 minute each)
LAN: LXRJA00415-160019577 Branch: RAJKOT Borrower: NITESHBHAI NARANBHAI KAMARIA Co-Borrower:	17-02-2020 for Rs: 733700/- (Rupees Seven Lac Thirty Three Thousand Seven Hundred Only)	Jay Chamunda Krupa, Sikshak Society 107 Street No - 2, Sanjay Nagar, Plot No 280, Gandhigram, Junagadh, S. No 308/2, Near Tejas School, Junagadh, Gujarat - 362001	Reserve Price: Rs.4,10,000/- (Rupees Four Lacs Ten Thousand Only) EMD: Rs.41,000/- (Rupees Forty one Thousand Only) Last date of EMD Deposit: 16-10-2023	Date: 17/10/2023 Time: 1:30 Pm to 02:00 Pm (with unlimited extensions of 5 minute each)

**Terms and Conditions of E-Auction:**

- The Auction is conducted as per the further Terms and Conditions of the Bid document and as per the procedure set out therein. Bidders may go through the website of Motilal Oswal Home Finance Limited (Earlier Known as Aspire Home Finance Corporation limited), [www.motilalosal.com](http://www.motilalosal.com) and website of our Sales & Marketing and e-Auction Service Provider, <https://auctions.invention.net>. In all bid documents, the details of the secured asset put up for e-Auction and the Bid Form which will be submitted online.
- All the intending purchasers/bidders are required to register their name in the Web Portal mentioned above as <https://auctions.invention.net> and generate their User ID and Password in free of cost of their own to participate in the e-Auction on the date and time aforesaid.
- For any enquiry, information & inspection of the property, support, procedure and online training on e-Auction, the prospective bidders may contact the Client Service Delivery (CSD) Department of our Sales & Marketing and e-Auction Service Partner **M/s. Invention Solutions Pvt. Limited**, through Tel. No.: +91 9029086321 & E-Mail: [care@invention.net](mailto:care@invention.net) or [manoj.das@invention.net](mailto:manoj.das@invention.net) or the Authorised Officer, Contact No.:- DATAR SINGH CHOUHAN - 8291180874 & Ankit Barot - 7045155624
- To the best of knowledge and information of the Authorised Officer, there is no encumbrance in the properties/ies. However the intending bidders should make their own independent inquiries regarding the encumbrance, title of properties/ies put up on e-Auction and claims/rights/affecting the property prior to submitting their bid. The e-Auction advertisement does not constitute any commitment or any representation of MOHFL. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to MOHFL. The Authorised Officer/Secured Creditor shall not be responsible in any way for any third party claims/rights/affects.
- For participating in the e-Auction, intending purchasers/bidders will have to submit/upload in the Web Portal (<https://auctions.invention.net>) the details of payment of interest-free refundable Earnest Money Deposit (EMD) of the secured asset as mentioned above by way of Demand Draft in favour of Motilal Oswal Home Finance Limited (Earlier Known as Aspire Home Finance Corporation limited) or by way of RTGS/NEFT to the account details mentioned as follows: **Bank Name: HDFC Bank, Branch: Lower Parel Mumbai, Bank Account No.: 00603040073530, IFSC Code: HDFC0000060** along with self-attested copies of the PAN Card, Aadhar Card, Residence Address Proof, Board Resolutions in case of Company and Address Proof on or before **04:00 PM of 16-10-2023**;
- The Property will not be sold below the Reserve Price. The Successful Purchaser/Bidder shall have to deposit the 25% (inclusive of EMD) of his/her offer by way of RTGS/NEFT to the account mentioned herein above within 24:00 hours from the completion of e-Auction, failing which the sale will be deemed to have been failed and the EMD of the said Successful Bidder shall be forfeited;
- The EMD of all other bidders who did not succeed in the e-Auction will be refunded by MOHFL within 72 working hours of the closure of the e-Auction. The EMD will not carry any interest.
- The balance amount of purchase consideration shall be payable by the Successful Purchaser/ Bidder on or before the fifteenth (15th) day from the date of 'Confirmation of Sale' of the said secured asset by the Authorised Officer/ Secured Creditor or such extended period as may be agreed upon in writing by the Authorised Officer at his/her discretion. In case of default, all amounts deposited till then shall be liable to be forfeited;
- Date of inspection of the Immovable Property is on **16-09-2023 between 11.30 AM to 04.00 PM**.
- At any stage of the e-Auction, the Authorised Officer may accept/reject/modify/cancel the bid/offer or postpone the e-Auction without assigning any reason thereof and without any prior notice. In case any bid is rejected, Authorised Officer can negotiate with any of the tendered bidders or other parties for sale of property by Private Treaty;
- The Successful Purchaser/ Bidder shall bear any conveyance duties, taxes, fees payable, stamp duty, registration fees, etc. that is required to be paid in order to get the property conveyed/delivered in his/her favour as per the applicable law;
- Sale is subject to the confirmation by the Authorised Officer;
- The Borrower/Guarantors, who are liable for the said outstanding dues, shall treat this Sale Notice as a notice under Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, about the holding of above mentioned auction sale;
- The Borrower(s)/Guarantor(s) are hereby given **30 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002** to pay the sum mentioned as above before the date of Auction failing which the immovable property will be auctioned and balance, if any, will be recovered with interest and costs. If the Borrower pays the amount due to MOHFL in full before the date of sale, auction is liable to be stopped.
- The Total Loan Outstanding amount is not the loan foreclosure amount. All other charges (if any) shall be calculated at the time of closure of the loan.
- MOHFL is not responsible for any liabilities whatsoever pending upon the property as mentioned above. The Property shall be auctioned on 'As Is Where Is Basis', 'As Is What Is Basis' and 'Whatever Is and 'no recourse' Basis'.
- The sale shall be subject to rules/conditions prescribed under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, as amended from time to time; It shall solely be the responsibility of the Successful Bidder/ Purchaser to get the sale registered. All expenses relating to stamp duty, registration charges, transfer charges and any other expenses and charges in respect of the registration of the sale for the above referred property shall be borne by the Successful Bidder/ Purchaser. The sale has to be registered at the earliest else the purchaser has to give the request letter to MOHFL mentioning the reason of delaying the registration;
- No person other than the intending bidder/offerer themselves, or their duly authorised representative shall be allowed to participate in the e-Auction/auction proceedings. Such Authorisation Letter is required to submit along with the Bid Documents;
- Special Instruction:** e-Auction shall be conducted by the Service Provider, M/s. Invention Solutions Pvt. Limited on behalf of Motilal Oswal Home Finance Limited, on pre-specified date, while the bidders shall be quoting from their own home/offices/ place of their Bid as per their choice above the Reserve Price. Internet connectivity and other paraphernalia requirements shall have to be ensured by bidders themselves. Please note that failure of Internet connectivity (due to any reason whatsoever it may be) shall be sole responsibility of bidders and neither MOHFL nor Invention/OS shall be responsible for these unforeseen circumstances. In order to ward-off such contingent situation, bidders are requested to make all the necessary arrangements/alternatives whatever required so that they are able to circumvent such situation and still be able to participate in the e-Auction successfully. However, it is requested to the Bidder(s) not to wait till the last moment to quote/improve his/ her Bid to avoid any such complex situations.
- The same has been published in our portal - <https://motilalosal.com/section-pd/>
- Please note that the secured creditor is going to issue the sale notice to all the Borrowers/ Guarantors/ Mortgagors by speed/ registered post. In case the same is not received by any of the parties, then this publication of sale notice may be treated as a substituted mode of service.

Place :Surat/Ankleshwar/Morbi/Rajkot  
Date : 09.09.2023

Sd/-  
Authorized Officer  
(Motilal Oswal Home Finance Limited)

**AMOL MINECHEM LIMITED**  
(Formerly known as Amol Dicalite Limited)  
Reg. Off: 401, "Akshay", 53, Shrimali Society, Navrangpura, Ahmedabad-380009.  
Ph: +91 79 40246246 • E-mail: info@amolminechem.com  
Web: www.amolminechem.com • CIN: U14100GJ1979PLC003439

**NOTICE OF 44th ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION & BOOK CLOSER NOTICE**

**NOTICE IS HEREBY GIVEN** that 44th Annual General Meeting (AGM) of Members of the Company is scheduled to be held on Saturday, September 30, 2023 at 11:00 a.m. at 401, "Akshay", 53, Shrimali Society, Navrangpura, Ahmedabad-380009, to transact the businesses as set out in the Notice of 44th AGM.

The Notice convening 44th AGM along with copy of the Annual Report for the financial year 2022-23 has been sent on September 07, 2023 to the members whose e-mail addresses have been registered with the Company / Registrars and Share Transfer Agent (RTA). The Notice convening 44th AGM is also available on the website of Central Depository Services Limited (CDSL) at [www.evotingindia.com](http://www.evotingindia.com).

In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using electronic voting system, provided by CDSL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Saturday, September 23, 2023 ('Cut-off date').

Remote e-voting period commences from 9:00 a.m. (IST) on Wednesday, September 27, 2023 and ends at 05:00 p.m. (IST) on Friday, September 29, 2023. The voting through remote e-voting shall not be allowed beyond 05:00 p.m. on September 29, 2023. Those Members, who has not casted their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through ballot papers during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM but shall not be entitled to cast their votes again. Members of the Company holding shares as on the cut-off date may cast their votes.

Any person who becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date may cast their votes by following the instructions and process of e-voting as provided in the Notice of the AGM.

The facility for voting through ballot papers shall also be made available at the AGM and Members who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at the AGM. The Members who have casted their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again.

Pursuant to the provisions of section 91 of the Companies Act, 2013, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Sunday, September 24, 2023 to Saturday, September 30, 2023 (both days inclusive) for the purpose of 44th AGM and dividend.

In case of any query, shareholders may refer the Frequently Asked Questions (FAQs) and e-voting user manual for shareholders available at the download section of [www.evotingindia.com](http://www.evotingindia.com) or call on Mr. Nitin Kunder (022-23058738) or Mr. Rakesh Dalvi (022-23058542/43) or e-mail at [helpdesk.evoting@cdsindia.com](mailto:helpdesk.evoting@cdsindia.com)

For, Amol Minechem Limited  
Sd/-  
**Shreyas C. Sheth**  
Managing Director  
DIN: 0009350

Date : September 07, 2023  
Place : Ahmedabad.

**KPI GREEN ENERGY LIMITED**  
(Formerly known as K.P.I. Global Infrastructure Limited)  
CIN: L40102GJ2008PLC083302

Regd. Office: 'KP House', Opp. Ishwar Farm Junction BRTS, Near. Bliss IVF Circle, Canal Road, Bhatar, Surat 395017, Gujarat, India

Tel & Fax: (0261) 2244757 E-mail: info@kpgroup.co Website: www.kpigreenenergy.com

**NOTICE OF THE 15th ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION**

NOTICE is hereby given that the 15th Annual General Meeting ('AGM') of the Company will be held on **Friday, September 29, 2023 at 11:00 a.m. through Video Conference ('VC')/Other Audio Visual Means ('OAVM')** to transact the businesses as set out in the Notice of AGM, which is being circulated for convening the AGM. The Company has sent Annual Report for the financial year 2022-23 along with the Notice convening AGM, through electronic mode to the Members whose email addresses are registered with the Company and/ or Depositories in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at [www.kpigreenenergy.com](http://www.kpigreenenergy.com) and on the website of Central Depository Services (India) Limited (CDSL) at [www.evotingindia.com](http://www.evotingindia.com).

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 ('Act') and the applicable rules framed thereunder that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, September 22, 2023 to Friday, September 29, 2023 (both days inclusive) for the purpose of 15th Annual General Meeting of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on **Friday, September 22, 2023 ('cut-off date')**.

The remote e-voting period commences on **Tuesday, September 26, 2023 at 09.00 a.m. IST and will end on Thursday, September 28, 2023 at 5.00 p.m. IST**. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to [helpdesk.evoting@cdsindia.com](mailto:helpdesk.evoting@cdsindia.com). However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions ('FAQs') and the e-voting manual available at [www.evotingindia.com](http://www.evotingindia.com) under help section or contact at 022-23058542/43. In case of any grievances relating to e-voting, please contact Mr. Rakesh Dalvi, Sr. Manager, at 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbai - 400013; Email: [helpdesk.evoting@cdsindia.com](mailto:helpdesk.evoting@cdsindia.com) or aforesaid number.

The details of the AGM are available on the website of the Company at [www.kpigreenenergy.com](http://www.kpigreenenergy.com), CDSL at [www.evotingindia.com](http://www.evotingindia.com), BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and National Stock Exchange of India Limited at [www.nseindia.com](http://www.nseindia.com).

**For KPI Green Energy Limited**  
(Formerly known as K.P.I. Global Infrastructure Limited)  
Sd/-  
**Rajvi Upadhyay**  
Company Secretary & Compliance officer

Place : Surat  
Date : September 7, 2023

I arrive at a conclusion not an assumption.  
Inform your opinion detailed analysis.  
The Indian Express.  
For the Indian Intelligent.

